

BUSINESS મિત્ર

લાજકેપ શેરોમાં દબાણ , પણ બ્રોડર માર્કેટમાં ફરીથી લેવાલીએ ચમક્યાં

બજારમાં ઉતાર-ચઢાવ છતાં રોકાણકારોએ રૂ. 2.૩0 લાખ કરોડ કમાયા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા. 18 : ફેડરેટના વધારાની અસર ધીમે ધીમે ઓસરતી જોવા મળી હતી અને આજે શરૂઆતથી જ સુધારાની ચાલ જોવા મળી હતી. એશિયન બજારો પણ પોઝિટિવ ચાલ રહી હતી, તેની પાછળ ભારતીય શેરબજારમાં સુધારાની ચાલ રહી હતી, પણ છેલ્લે આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતારચઢાવ જોવા મળ્યો હતો. નિફ્ટી 23300 પોઈન્ટની સપાટી વટાવીને બંધ રહી હતી.

મુરીડે ભારતના નાણાકીય વર્ષ 2027 જીડીપી વૃદ્ધિની આગાહીને 7 ટકા સુધી વધારવાથી બજારના સેન્ટિમેન્ટને વધુ મદદ મળી હતી, જે પશ્ચિમ એશિયામાં સતત ભૌગોલિક રાજકીય તણાવ હોવા છતાં સ્થનિક અર્થતંત્રમાં મજબૂત ચાલ જોવા મળી રહી છે. બ્રોડર માર્કેટમાં તેજના પગલે રોકાણકારોએ રૂ. 2.30 લાખ કરોડની કમાણી કરી છે.

સેક્ટર વાર્ઝ જોઈએ તો મેટલ, મીડિયા અને રિયલ્ટી શેરોમાં સુધારો થયો હતો, જ્યારે આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં નરમાઈ જોવા મળી હતી. જોકે, આજે હેવીવેઈટ શેરોમાં બેઉતરફી હવામાન રહ્યું હતું, જ્યારે બ્રોડર માર્કેટમાં લેવાલી નીકળી હતી, જેથી મજબૂત બંધ રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ 19.63

	નરેશ / મુકેશ દીવાળા	
પ્રકુલ/સાલસર/કેપીટલ રૂ.	3૦/૨૪ બ્રાઇટ	3૦૧.૩૫
3૦/3૬ એફડી	30૮.૪૫	
લોહક		
૬૨/3૬ કિમ્	૧૬૮.૫	
૬૮/3૬	૧૬૫.૫	
૭૦/3૬ કિમ્	૧૬૬.૫	
૭૮/૩૬ કિમ્	૧૫૫.૫	
૮૦/૩૬ કિમ્	૧૬૨.૫	
૮૫/૪૪ કિમ્		
૮૦/૭૨ ચો.	૧૬૭.૫	
૮૦/૩૬ ચો.	૧૬૮.૫	
૧૧૦/૪૮બ્રાઇટ	૧૬૦	

સોના-ચાંદી સુરત	તેલ બજાર સુરત	જથ્થાબંધ ખાંડબજાર
(ટ્રેડ સહિત)	૧૫ કિલોના ભાવ	પ્રતિ ક્વિન્ટલ ભાવ (રૂ.)
સેટાન્ટ્ડ સોનું	૧૫૮૫૭૦	મહારાષ્ટ્ર
તેબળી સોનું	૧૫૮૪૮૦	એમ-૩૦ (ભરવાલાચક)
દાગીના-૨૨ કેરેટ	૧૫૦૬૪૦	એમ-૩૦
દાગીના-બીએસઆઈ હોલમાર્ક	૧૫૫૪૦૦	એસ-૩૦
સોનાનાં બિસ્કીટ	૧૫૮૫૭૦૦	ગુજરાત
ચાંદી (૯૯૯)	૨૪૪૨૦૦	એમ-૩૦
ચાંદી સિક્કા	૨૪૪૭૦૦	એસ-૩૦

છેલ્લા પાંચ વર્ષમાં મેગા સિટીના બદલે શહેરોમાં મકાનોના ભાવ વધુ ઉછળ્યા

છેલ્લા 10 વર્ષમાં

આઠ મોટા શહેરોની

સરખામણીએ ટાયર-2ના

11 શહેરોમાં મકાનોના

ભાવ બમણા થઇ ગયા

નવી દિલ્હી, તા. 18: દેશના આઠ મોટા શહેરોની સરખામણીએ છેલ્લા એક દાયકામાં ટાયર-2ના 11 શહેરોમાં મકાનોના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. વિકાસના આગળના તબક્કામાં દેશમાં નાના શહેરોની રિયલ એસ્ટેટ સેક્ટરમાં ભૂમિકા જોવા મળશે. સીઆઈઆઈ-નાઈટ ફેન્ડના અહેવાલમાં જણાવાયું છે કે, 2016થી

2026ની વચ્ચે, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ટ્રાઈસિટી, ગોવા, ઈન્દોર, જયપુર, કોચી, નાગપુર, વિશાખાપટ્નમ અને કોઈમ્બતુરમાં મકાનોના ભાવમાં 9 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિદર જોવા મળ્યો છે. તેની સરખામણીએ દેશના આઠ મોટા શહેરોમાં મકાનોના ભાવમાં સરેરાશ 4 ટકાના સીએજઆરના દરે વધારો થયો છે. ધરોના ભાવ વધારાના સંદર્ભમાં સૌથી મોટા અને ટાયર-2 શહેરો વચ્ચેનું આ અંતર છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વધ્યું છે. 2021 અને 2026ની વચ્ચે, ટાયર-2 કેટેગરીના 11 શહેરોમાં મકાનોના ભાવમાં 63 ટકાનો વધારો થયો છે.

ફૂડ ઓઈલના ભાવ સતત ત્રીજા દિવસે ઘટીને 102 ડોલરની નીચે

સાઉદી હારા

પાઇપલાઇનનો 50 ટકા

હિસ્સો પુન:સ્થાપિત

કરવાના પગલાંની

અસર

મુંબઈ, તા. 18: સાઉદી અરેબિયા દ્વારા ‘ઈસ્ટ-વેસ્ટ પાર્થિવલાઈન’નો 50 ટકા હિસ્સો થોડા જ દિવસોમાં પુન:સ્થાપિત કરવાના પગલાં વચ્ચે બ્રેન્ટ ફૂડ ઓઈલના ભાવ ઘટીને 102 ડોલર પર પહોંચ્યા છે. આ ઉપરાંત સાઉદીની અપીલ બાદ બીજિંગે પણ ઈરાનને અપીલ કરી છે કે હૂતીઓને નિયંત્રણમાં રાખે. બીજી

બાજુ જે પી મોર્ગનના પણ ફૂડ માટે નિવેદન આવ્યા છે જે ફૂડ માટે કોઈ બેઝલાઈન અમુખાન નથી. યુદ્ધનો અંત કે વ્હીરીતે આવશે તેનું મોડેલ અત્યારે કઠિન લાગી રહ્યું છે. ગ્લોબલ રિસ્ક મેનેજમેન્ટ કહે છે કે, કિંમતો ઘટી છે પણ સલાયતી ચિંતા હજી પણ માર્કેટમાં છે કે ફૂડ માટે ચિંતાનો વિષય છે. યુ એસ ઈન્વેન્ટરીમાં પણ સુધારો થઈ રહ્યો છે તેની અસર પણ આપણે ફૂના ભાવ પર જોઈ રહ્યા છે. બજારને લાગી રહ્યું છે કે ફૂડના ભાવ પ્રતિ બેલર 95 ડોલરથી લઈ 105 બેલરની રેન્જ જળવાશે. ભોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો નોંધાયો છે રોકાણ થાંડું ઈન્ડિવટી તરફ પણ ગયું છે. 100 ડોલર પ્રતિ ડોલરની સપાટી હાલ પૂરે તેમ નથી લાગતું તે માટે થોડું વધુ દબાણ આવશ્યક છે.

દાદીમાના નુસખા
મીનુ પરબીઆ - રયોમંદ પરબીઆ
યોનિ અસલતા યોનિમાં અમલતા હોય તો, શુક્ર કોષો તેમાં જીવી શકતા નથી અને પરિણામે ગર્ભ ધારણ થતો નથી . તેથી તરત તમારી નજીકના સ્ત્રી રોગ નિષ્ણાતનો સંપર્ક કરો. ક્યારેક સહેલાઈથી નિવારણ થઈ જાય છે.

કોઈ પણ સાલમાં 19 સપ્ટેમ્બરે જન્મેલાનું વર્ષ ફળ
આજથી શરૂ થતું આખનું નવું વર્ષ સામાન્ય રહેશે. નોકરી-દંધાના કામમાં નવી તક મળે. ટેકનોલોજીનો લાભ મળે. નવી જવાબદારીથી કામનો બોજ વધે. આરોગ્ય નસર રહે. ઉંચાણીની ચિંતા રહે. સમાજમાં સામાન્ય રહે. પરિવારની મદદ મળે. આર્થિક બાબતે સામાન્ય રહે. સરકારી કામ, કોર્ટ, કચેરીમાં સામાન્ય રહે. સંતાનોના અભ્યાસ-કેરીયરમાં પ્રગતિ થાય. આવક વધારવાની નવી યોજનામાં મિશ્રેણો સાથે મળે. ઉંમર લાગકના વિવાહ થાય. પ્રેમ વિવાહમાં મદદ મળે. કિલેશનાં કામ દીર્ઘાં પડે. વિદ્યાર્થીઓને ભાગ્યનો સાથ મળે. વારસા, ખચકાદ, જમીન વેંચા કામ દીર્ઘાં પડે. નવી નોકરીની તક ઊભી થાય. વર્ષ દરમિયાન નવા રોકાણમાં સાવધાની રાખવી. નવા ઘર, વાહન, મકાનોની યોજના શરૂઆતમાં સફળ બને. સાત્રા-પ્રવાસ, દર્મ-કાર્યથી શાંતિ મળે. પુલાઈ એગ્રીકેટ, રફિ-સોમવાર, 01, 10, 28 વારીએ નવા કામ કરવો. સોરઠી, ભૂરા, કથઈ કેંગનો ઉપયોગ વધારવો. નવેમ્બર-ડિસેમ્બર, શુક્ર-શનિવાર, 07, 16, 25 તારીખે, નવા કામ ટાળવો. શ્યામ રંગનો ઉપયોગ ટાળવો.

આજનું પંચાંગ
તા. 19/09/2026, શનિવાર
વિક્રમ સંવત : 2082
વીર સંવત : 2552
તિથિ: સુદ: આઠમ: 15-૨૬- દુર્ગાષ્ટમી
અયન : દક્ષિણાયન
રાષ્ટ્રિય દિનાંક : (ભદરવા: 28
યોગ: આરુચ્યમાન કરમ: ભાવન
નક્ષત્ર : જ્યેષ્ઠા:૨૨:૫૬ સુદી જન્મેલાની જ્યેષ્ઠા અને તે પછી મુળની શાંતિ કરાવાયી
રાશિ: ધન (મ.ધ.ફ.રૂ.)
દિવસ : અશુભ- રાદાઇતમી, ઘરો આઠમ, દિગ્ધિજાતી, ગૌરીવિષયન
સુવર્તમાં સુચકિય : ૦6:28 સુવર્તમાં સૂચકિત : 18:૩7
નવકારકો : 07:1૧
પાસર્તી વર્ષ : 1396 અરદીબેહેસ્ટ માસનો 0૬ઠી રોજ
સુલભમાન્દર : 1448, રવિઉત્ર આખર માસનો 07મો રોજ
દિવસનાં ચોથકિયો: કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ,
રાત્રિનાં ચોથકિયો: લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
રાહુ કાળ : સવારે : 09:૩૦થી 11:૦૦ સુધી

મેષ (અ,લ,ઇ,):
બુદ્ધિ ક્ષમતા અને વ્યવહાર કુશળતાથી કાર્યમાં ગતિ સાવે અને નવા પ્રોજેક્ટની શરૂઆત થાય.
વૃષભ (બ,વ,ઈ,):
નવા રોકાણ અને વૈભવમયાર્થે સોદા ટાળવાં વાણી પર કાનૂી રાખવો. ચોર-તૂટારૂંથી સાવધાન.
મિથુન (ક,છ,ઘ,):
સમાજિક સમસ્યા સતાવે. રોજીના કામમાં મન ઓછું લાગે બહારસાધનો કામમાં મદદ મળે.
કર્ક (સ,ઠ,):
નોકર-ચાકર અને હડીકોથી નુકસાન થઈ શકે છે. સરકારી નોકરિયાત લાવશથી બચવું.
સિંહ (મ,ર,):
જીવન સાથી-સંતાનોના કામમાં મદદ મળે.

આપની આજ

જયોતિષાચાર્ય હંસરાજ

મિત્રો સાથે મનોરંજન થાય. આવક વધારવાની યોજના બાબતે.
કન્યા (પ,ઘ,ણ,): બૌદ્ધિક અને રચનાત્મક કાર્ય સફળ બનશે. પરીક્ષામાં સફળતા મળે. સંતાનોના કામમાં પ્રગતિ થાય.
તુલા (ર,ત,): દીરવ્ય રાખવી પડશે. દેકે જગ્યાએ લાલમેળથી કામ કરવું પડશે. અચાનક નવી જવાબદારી આવશે.
વૃશ્ચિક (ન,ય,): વાણી પર કાનૂી રાખવું. સાહસિક નિર્ણય લેવાય. વારસા લીધેલા કામમાં નવી બાબતે મદદ મળે. આવક

વધે.

ધન (ભ,ધ,ફ,ટ,):

પ્રગતિના નવા રસ્તા ખૂલે. આત્મવિકાસ વધશે. સરકારી યોજનાનો લાભ મળે. વિવાદથી બચવું.
મકર (ખ,જ,): સાંખીની કામગીરી રાખવી. સરકારી કામમાં વિદ્ધો આવે. સામાજીક કામમાં યશ મળે.
કુંભ (ગ,સ,શ,ષ,ય,): મિત્રો સાથે મનોરંજનની સાથે સામાજિક પ્રગતિ થાય. પ્રેમમાં દીરવ્ય રાખવી. ગુસ્ ભય રહે.
મીન (ઝ,ઞ,ત,થ,ય,): સ્ત્રી વર્ગને ઉપયોગી યોજા વસ્તુના વેપાર અને દીવાળના કામમાં નવી તકથી લાભ થાય.

બેંકમાંથી ઉપાડેલી રોકડ પુન: જમા કરવામાં વાંધો છે?

કરદાતા દ્વારા બેંકમાંથી રોકડ ઉપાડ અનેકવિધ કારણસર કરવામાં આવતો હોય છે. ઈન્કમેટેજ ખાતાને એનો વાંધો નથી પરંતુ રોકડ ઉપાડ કે જે ચોપડે રોકડ લેજરમાં ‘કેશ બેલેન્સ’ તરીકે બોલે છે તે પુન: બેંકમાં જમા કરવામાં આવે છે. હવે ઈન્કમેટેક્ષમાં આવા ‘કેશ ડિપોઝીટ’ના કેઈસો ખૂલે છે. ત્યારે આવકવેરા અધિકારી બેંકમાં જમા રકમ અંગેનો આ ખૂલાસો સહજ રીતે માનવા તૈયાર હોતા નથી જેના કારણોમાં ખાસ કરીને હાથ ઉપર આટલી બધી રોકડ રાખવાનું કોઈ કારણ નથી. કરદાતાએ અન્યત્ર રોકાણ કર્યું છે. વિગેરે.

આવી જમા રકમ ઈન્કમેટેજ કાયદાની કલમ-68 અને 69 અંગે સ્ત્રોત (Sow-rec)ના ખૂલાસા અપૂરતા હોવાને લઈને આવકમાં ઉમેરા થાય છે.

આવકવેરાનો અભિગમ

સોરાબ અગ્રવાલ દિલ્હી ટ્રીબ્યુનલના ચૂકાદામાં આવકવેરા અધિકારીએ કલમ-68 માં કેશ કેડિટ ઉમેરો કરતાં એવું સ્ટેન્ડ લીધુ કે કરદાતાએ અલગ અલગ તારીખે રોકડ ઉપાડ કર્યો છે અને ચોપડે રોકડ બેલેન્સ હોવા છતાં આવુ અલગ અલગ તારીખે ઉપાડનું કોઈ કારણ નથી જે સામે ટ્રીબ્યુનલે એવુ કરાવ્યુ કે અગાઉની ઉપાડેલ રકમ ફરીથી

જમા કરાવવા અંગે ઉપલબ્ધ હતી તેથી સંભવિત ખૂલાસો માન્ય રાખવાને પાત્ર છે. કરદાતા ક્યારે ઉપાડે અથવા કયા પ્રસંગે ઉપાડે એનક્કી કરવાનું એનું કામ છે. કરદાતાએ અમુક જ રીતે ઉપાડ કરવો જોઈએ એ અનઅપેક્ષિત છે.

વળી કરદાતાએ બે વર્ષ સુધી રોકડ કેમ હાથમાં રાખી એ કરદાતાનો વિષય છે એવું બેંગ્લોર ટ્રીબ્યુનલે સંપતરાજ રોકેશ કુમારમના કેઈસમાં ક્ષણાટિક રાઈકોર્ટના એસ.આર. વેંકટરામનના ચૂકાદાનો આધાર લઈ કરાવ્યું છે.

ટેક્સ રિવટર	વિરેશ રૂદલાલ
અમદાવાદ ટ્રીબ્યુનલ	અલગ અલગ ટ્રીબ્યુનલના ચૂકાદાઓનો અભ્યાસ કરતાં એક સમાન તારણ નીકળે છે કે બેંકમાંથી ઉપાડેલ રોકડ, કરદાતાએ અન્યત્ર રોકાણ કરી નથી એ સંજોગોમાં ડિપોઝીટનો સ્ત્રોત સમજાવી શકાયેલ છે, ખૂલાસો માન્ય છે, કોઈ ઉમેરો થઈ શકે નહિ.
અમદાવાદ ટ્રીબ્યુનલ	સુધારી પ્રવિણભાઈ ઠાકર, પ્રિતી રાજેશ ઠક્કર, નવીનચંદ્ર રામજીભાઈ ચાવડા વિગેરે વિવિધ અમદાવાદ ટ્રીબ્યુનલના ચૂકાદા છે. જે તારણોને
અલગ અલગ ટ્રીબ્યુનલના ચૂકાદાઓનો અભ્યાસ કરતાં એક સમાન તારણ નીકળે છે કે બેંકમાંથી ઉપાડેલ રોકડ, કરદાતાએ અન્યત્ર રોકાણ કરી નથી એ સંજોગોમાં ડિપોઝીટનો સ્ત્રોત સમજાવી શકાયેલ છે, ખૂલાસો માન્ય છે, કોઈ ઉમેરો થઈ શકે નહિ.	સુધારી પ્રવિણભાઈ ઠાકર, પ્રિતી રાજેશ ઠક્કર, નવીનચંદ્ર રામજીભાઈ ચાવડા વિગેરે વિવિધ અમદાવાદ ટ્રીબ્યુનલના ચૂકાદા છે. જે તારણોને

સોરાબ અગ્રવાલ દિલ્હી ટ્રીબ્યુનલના ચૂકાદામાં આવકવેરા અધિકારીએ કલમ-68 માં કેશ કેડિટ ઉમેરો કરતાં એવું સ્ટેન્ડ લીધુ કે કરદાતાએ અલગ અલગ તારીખે રોકડ ઉપાડ કર્યો છે અને ચોપડે રોકડ બેલેન્સ હોવા છતાં આવુ અલગ અલગ તારીખે ઉપાડનું કોઈ કારણ નથી જે સામે ટ્રીબ્યુનલે એવુ કરાવ્યુ કે અગાઉની ઉપાડેલ રકમ ફરીથી

સીધા કરવેરાની આવક નાણાકીય વર્ષ 2027માં 13 ટકા વધીને રૂ. 12.12 લાખ કરોડ

STTની આવકમાં 53

ટકાનો વધાવો થયો,

રિફંડમાં 29 ટકાનો વધારો

મુંબઈ, તા. 18: નાણાકીય વર્ષ 2027માં અત્યાર સુધીમાં સીધા કરવેરાની આવક 13 ટકા વધીને રૂ. 12.12 લાખ કરોડ થઈ છે, જ્યારે સિક્કોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ STTની આવકમાં 53 ટકાનો વધારો થયો છે. સરકારે 17 સપ્ટેમ્બર સુધીમાં રૂ. 2.20 લાખ કરોડના રિફંડ જારી કર્યા હતા, જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારો ફુંગાવાને તેના 2 ટકા લક્ષ્યથી ઉપર વધવાના જોખમને દુર કરવાનો છે. યુરોબોન્ડ બજારોમાં એફટીએસઈ 1.09 ટકા, કેક 1.28 ટકા અને ડેક્સ 1.09 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. એશિયન બજારોમાં નીક્કી 1.36 ટકા, હૅંગસેંગ 0.59 ટકા, તાઈવાન 1.89 ટકા, કોસપી 2.59 ટકા અને શાંઘાઈ 0.93 ટકા વધ્યા છે. જ્યારે સ્ટ્રેઈટસ 0.29 ટકા અને જકાર્તા 0.33 ટકા ઘટ્યા છે.

યુએસએ પછી જાપાનની સેન્ટ્રલ બેન્કે પણ વ્યાજદરમાં વધારો કર્યો

કુગાવાને ધ્યાનમાં રાખીને બેન્ક ઓફ જાપાને પણ 25 બેસિસ પોઇન્ટ વ્યાજદર વધાર્યા, 31 વર્ષની ટોચે પહોંચ્યા

નવી દિલ્હી, તા. 18: યુએસએ પછી જાપાનની સેન્ટ્રલ બેન્કે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે. બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે દેશનો મુખ્ય વ્યાજદર 1.25 ટકા પર પહોંચી ગયો છે. 1995 પછી જાપાનમાં આ પહેલીવાર વ્યાજદર આ સ્તરે પહોંચ્યા છે. અગાઉ બેન્ક ઓફ જાપાને પણ જુનમાં દરમાં વધારો કર્યો હતો. 1990 પછી આ પહેલીવાલ છે, જ્યારે બેન્ક ઓફ જાપાને આટલા ટુંકગાળામાં દરમાં વધારો કર્યો છે. જાપાન વસ્તા વધારેક દબાણનો સામનો કરી રહ્યું છે. આ જ કારણ છે કે તે

તેની દાયકાઓથી ચાલી આવતી અટ્ટુ લો વ્યાજદરની નીતિથી દુર જઈ રહ્યું છે. આ બેન્ક 2024થી વ્યાજદર વધારી રહી છે. જ્યારે તે માર્ઇસન 0.1 ટકા હતી. ત્યારથી બેન્ક ઓફ જાપાને છેલ્લા અઢી વર્ષમાં છ વરખત દરોમાં વધારો કર્યો છે. જાપાન અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં સતત નબળો યેન, વધતી કિંમતો અને ઘટતી કાર્યબળનો સમાવેશ થાય છે. જાપાનનું વ્યાજદરમાં 25 બેસીસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે દેશનો મુખ્ય વ્યાજદર 1.25 ટકા પર પહોંચી ગયો છે. 1995 પછી જાપાનમાં આ પહેલીવાર વ્યાજદર આ સ્તરે પહોંચ્યા છે. અગાઉ બેન્ક ઓફ જાપાને પણ જુનમાં દરમાં વધારો કર્યો હતો. 1990 પછી આ પહેલીવાલ છે, જ્યારે બેન્ક ઓફ જાપાને આટલા ટુંકગાળામાં દરમાં વધારો કર્યો છે. જાપાન વસ્તા વધારેક દબાણનો સામનો કરી રહ્યું છે. આ જ કારણ છે કે તે

શિશુ આહારના ઉત્પાદનો અંગે નેસ્લે ઈન્ડિયા સામે FSSAIએ કાનૂની કાર્યવાહી શરૂ કરી

શિશુ આહારના ત્રણ

ઉત્પાદનોમાં પોષક તત્વોની

હાજરી સહિતના દાવાઓ

ખોટા જણાયા

ખેરારાતો ગેટમાર્ગ

દોરનારી અને શિશુ

આહાર અંગેનો નિયમનો

ભંગ કરનારી જણાઇ

નવી દિલ્હી, તા. ૧૮: ખાદ્ય નિયાંયક FSSAIએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે શિશુ પોષણના ત્રણ ઉત્પાદનોમાં

નિયમોના કથિત ભંગ બદલ નેસ્લે ઈન્ડિયા સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે, જોકે આ FMCG ડિગ્ગજ કંપનીએ દાવો કર્યો છે કે તે તમામ લાગુ પડતા નિયમોનું ‘પૂર્ણપણે પાલન’ કરે છે. આ કાનૂની કાર્યવાહી NAN Excella Pro Stage 1, Lactogen Pro 1, અને એક કોલો-અપ ફોર્મ્યુલા પ્રોડક્ટના સંદર્ભમાં શરૂ કરવામાં આવી છે. NAN Excella Pro Stage 1 માં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ “SHMOs” અને “બે પ્રોટીન” થી

સંબંધિત દાવાઓ સામે વાંધો ઉઠાવ્યો

ગુજરાત હાઈકોર્ટ મનોજ ચોક્સીમાં માન્ય રાખ્યા છે.

ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ટ્રીબ્યુનલે મનોજ ઈન્વદન ચોક્સીના કેઈસમાં ઠરાવ્યું કે રોકડ ઉપાડ અને રોકડ બેંકમાં ભરવા અંગે કોઈ વિસંગતતા જણાય નથી. અલબત્ત કરદાતાએ લોન આપેલ છે પરંતુ વ્યાજનો ખર્ચ ઉધાર્યો નથી અને અધિકારીએ એ માન્ય રાખ્યો છે. રોકડ બેંકમાંથી ઉપાડવા અને ડિપોઝીટ કરવા અંગે કોઈ લીમીટ નથી. કરદાતાએ દરેક નાણાંકિય વ્યવહારો અંગે સ્પષ્ટતા કરી છે. અધિકારીએ એવુ સાબિત કર્યું નથી કે ઉપાડેલ રોકડ કરદાતાએ અન્યત્ર રોકી છે અથવા રોકડ બેલેન્સ સાચી નથી. (ગુજરાત હાઈકોર્ટ રેવન્યુની અપીલ રદ કરી છે)

ઉપસંહાર ઘણીવાર કરદાતા દ્વારા બે વર્ષ કે તેથી વધારે સમય માટે રોકડ હાથ પર રાખવામાં આવતી હોય છે. પરંતુ આ અંગે કરદાતાએ રોકડ લેજર વિગેરે પૂરાવાઓ રાખીને એસેસમેન્ટમાં વ્યવસ્થિત રજૂ કરવા પડે છે. અને હાથ પર રોકડ રાખવાના વ્યાજબી ખૂલાસો જેવો કે અસાધ્ય બિમારી, જમીનમાં રોકાણ વિગેરે જરૂરી છે.

</